

# IIT ગાંધીનગર કલ્ચર હેરિટેજની જાળવણી માટે ૩ડી ડિજિટાઇઝેશન કોર્સ શરૂ કરશે

નવગુજરાત સમય > અમદાવાદ

હેરિટેજની જાળવણી માટે IIT ગાંધીનગરે ૩ડી મોડેલ્સનો “૩ડી ડિજિટાઇઝેશન ફોર કલ્ચરલ હેરિટેજ” કોર્સ શરૂ કર્યો છે. આ કોર્સ ૩ડી ડિજિટાઇઝેશનની વિવિધ રીત અને ટૂલ્સ પર ફોકસ કરશે જે આપણા હેરિટેજની જાળવણીમાં મદદરૂપ બનશે. નવેમ્બર ૩૦થી શરૂ થતો આ કોર્સ ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન એકેડેમિક નેટવર્કની MHRD સ્કીમના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ, એન્જિનિયર્સ, ઉત્પાદન ક્ષેત્રના સંશોધકો, સરકારી કચેરીઓના કર્મચારીઓ, બી.ટેક, એમએસસી, એમ.ટેક, પી.એચડીના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે એનરોલ કરી શકશે. આ કોર્સની તાલીમ ૩ડી ડિજિટાઇઝેશનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ડો. માર્ક કેલીરી આપશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ ૩ડી સ્કેનિંગ ટેકનોલોજી અને તેને કલ્ચરલ હેરિટેજ ફિલ્ડમાં કેવી રીતે વાપરવી તે અંગે શીખી શકશે.